

મેનોપોર્ઝનું પરેજુ પત્રક

અનાજ / કટોળ	દૂધ અને દૂધની બનાવઠો	પિલાર
<p>શું હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ એક વર્ષ જુના દાઉં, છોખા હેવા. ■ અગ દેશી જાણના થી અણવા તલણા તેલામાં હણાઈને જ હેવા. <p>શું ન હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ સાખો, કોદણી હોવા ઘણણ ઓછા હેવા. ■ વાણ, રણણા ન હેવા. ■ કાચા કણાબાહેલા કઠોળ ન હેવા. 	<p>શું હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ દેશી જાણનું થી, દૂધ હેઠું ■ મિલામિત દેશી જાણનું દૂધ પીવાથી હાડકાળો ઘસારો, ચીડિયાપણું, અનિદ્રા હળેણે દૂર થાબ છે. ■ જાણના ૩ કલાક બાદ, રાતે શૂં હણતે દેશી જાણનું થી ઉપરોક્તિને પીવું. <p>શું ન હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ દાઢી રાતે ન હેઠું. ■ દાઢી, થી, લાકર કે જામણા ઉપરોક્તિ હિના ન જ હેઠું. 	<p>શું કરવું :</p> <ul style="list-style-type: none"> ■ મન શાંત રાખવું. ■ હિંદુમાં ૧૦-૧૫ મિનિટ જેટથું એકાંતમાં પેરોને હેં નું ઉચ્ચારણ કરવું ટેમજ પ્રાણાચાર કરવા. ■ સંભોષણી જુદાનું અને શક્વ હોટલી બીજાને મદદ કરવી. તેનાથી પોતુંની વાતાવરણ જની, હોમ્માનની સમતુલા જણાવ્ય રહે છે. ■ રાતીના આંદોલાં આંદોલી જ કલાક ઉંઘ ગોકુલા હેઠો... જે રાતે ૧૦ વાગ્યા થી રહાએ પ વાગ્યાની ઘનોની હોલો બોંધાને. ■ આખા શરીરે ગરુદ તાલના તેલની માલિશ કરવી, શરીર ન હોય તો રોજ માયાંા, કાળમાં અને પગમાં ગરુદ તાલના તેલની માલિશ કરવી. ■ હળવો જાણાન કરવો.
<p>શાકાખાજી</p> <p>શું હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ પરંપરા, અરંગથો, દૂઢી હવેણે ખાંડ હેવા બોંધાને. ■ ગરુદ પ્રફુલ્લિ ન હોવા હેણે ઉસણ દોષ હેઠું બોંધાને. ■ મેદીની બાજુ, ડોડીની બાજુ, પાલકની બાજુ, લાંદાખાની બાજુ, કારંગવો દાંગેણો ઉપરોક્ત કલરો બોંધાને. ■ લેખા અન્ધવાડીયાંની એક વખત લારંગવાના પાણનાં મૃહિયાં જનાતીને વર્ષ શાન્દાબ છે. <p>શું ન હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ જાણાની ઉપરોક્ત ન કરવો. 	<p>પ્રવાહી</p> <p>શું હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ ઉકાળીને હેઠું પાણી પીવું. <p>શું ન હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ હિયનું પાણી ન પીવું. ■ જખાદુ ઠંડા પીણાં (કોલ્ડ્રિકસ) ન હેવા. 	<p>શું ન કરવું :</p> <ul style="list-style-type: none"> ■ મળ-મૂત્ર હેણે કચારેય રોકડા નહીં (રોકવાથી તે ભાગનો વાયુ વિફુલ થઈ કળજુયાંત થઈ શકે છે.) રાતે ઉલંગરા ન કરવા. (ખેળાથી શરીરની પ્રાણીતિક સમતુલા ખોરવાઈ જાય છે.) ■ ચિંતા ન કરવી.
<p>કૃષા</p> <p>શું હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ કુલસા, કાળીદાસા, બોર, પાકેલા કેળા, લાડકણ, મીઠું દાડન, પાણું પીવું, કોણું, ઘરે પકાવેણી મીઠી કંચી, ખષૂદ હેવા. ■ સુદા સેવાના આનદોટ, ચંદ્રુદ, કાજુ, કાંચનીલ હેવા. <p>શું ન હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ ખૂબ માટા કુઠી ન હેવા. સોંગની, જારંગની ઘરેણે મીઠા હોવા તો જ હેવા. 	<p>આદાર</p> <p>શું હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ જમ્યા પઢેલા હરકે નો ટુકડો કે હીમેજ દેશી ગોળ સાવે ચાવવો. ■ ગળાપણામાં સાકર, દેશી ગોળ હેવા. ■ મુખવાસ, તલ, સુવા, વરીયાણીનો જાણના દેશી થી માં શેકેલો મુખવાસ જમ્યા બાદ થોડા જ પ્રમાણમાં હેવો. ■ દુસેશા તાણો જનાપેલો ખોરાક જ હેવો. ખોરાક જનાવાના વદ્યું વદ્યું વધુ ૩ કલાક લુટીમાં લઈ હેવો. <p>શું ન હેઠું :</p> <ul style="list-style-type: none"> ■ દૂધની સાવે તમામ ખાટા ફળો, અણાણો, અણાણાણી પસ્તુલો, કુગળી, લાલ, મૂજા, જાજર તથા ખરી વદ્યુલો ન ખાવી. ■ પદ્ધાદે પડતું ખાંદુ-ખારાં-તીખું ન ખાવું. ■ ભૂખાં ન રહેણું-વધારે ઉપવાસ પણ ન કરવો. મેંદાવાણી વદ્યુલો ખેમ કે ટોલેટ, પારી, બિલ્ડિંગ, પાર્ટી, પ્રેટ વગેરે નિલકુલ ન હેવા. 	

કૃમિરોગ (કરમીયા) માટેનું પરેજુ પત્રક

અનાજ / કઠોળ	પ્રવાહી	વિહાર
<p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> એક વર્ષ જુના ચોખા અને ઘઉં લેવા. મગને બાફીને અથવા તેલમાં વધારીને જ ખાવા. તુવેરદાળ ખાઈ શકાય. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> સિગ્નના નવા ઘઉં, ચોખા ન લેવા. મેદાની વસ્તુઓ જેવી કે ટોસ્ટ, ખારી, બિસ્કિટ, પાઉં, ભેડ, કેક, પંલાણી નાન બિલકુલ ન લેવા. અડદ બિલકુલ ન લેવા. 	<p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> હંમેશા ઉકાળેલું પાણી પીવું. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> તરસ કરતા વધુ પાણી ન પીવું. ફિઝનું પાણી બિલકુલ ન પીવું. મીઠા-ખાટા કલરવાળા બજારું હંડા પીણાં, બોર્નવિટા, ડ્રાયકૂટ (કોલિંક્સ) ન પીવા. 	<p>શું કરવું :</p> <ul style="list-style-type: none"> ચોજ અડદી કલાક સુધી કોઈપણ પ્રકારની કસરત કરવી. અથુ અનુસાર સમયાંતરે નજુકની આયુરોપિક હોસ્પિટલમાં થિક્સિલ્સની સલાહ અનુસાર થિક્કિંસા કરાવવી. બધારથી રોમે ઘરે આવ્યા બાદ હાથ, પગ હેંડવોશ/સાખુથી બરાબર સાફ્ કરવા. બાળકની વાર્ચવાર મોંમાં આંગળીઓ નાખવાની આદત ખાસ છોડાવવી. રાતે સૂતી સમયે મળખારના સ્થાને સરસિયુ તેલ લગાવી આપવું. પંદર દિવસે એકવાર બાળકને કાંકચા/કાંકચિયાનો પાવડર ગરમ પાણીમાં આપવો.
<p style="text-align: center;">શાકભાજુ</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> પરવળ, બથવાની ભાજુ, સરસવની ભાજુ, કારેલા, રીંગાળા, સરગવો, દૂધી, ગલકા, તૂચિયા જેવા લીલા શાકભાજુનો ઉપયોગ વધુ કરવો. ગુંડા કરમિયાને દૂર કરે છે. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> બટેટા જેવા કંદ, ભીડાનું શાક ન લેવું. 	<p style="text-align: center;">આહાર</p> <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> દૂધની સાથે તમામ ખાટા ફળો, અથાણાં, આથાવાણી વસ્તુઓ, કુંગળી, લસણ, મુણા, ગાજર તથા ખારી વસ્તુઓ ન લેવી. શેરડીનો રસ, ગોળ, ખાંડ, ચોકલેટ, મીઠાઈ ન લેવા. વધારે ખાટુ જેમ કે આમલી ન લેવી. ખાવામાં લીંબુના કૂલનો બિલકુલ ઉપયોગ ન કરવો. એકવાર જમ્યા બાદ ઓછામાં ઓછું ચાર કલાક સુધી કઈ જ ખાવું નહીં. જમ્યા ઉપર તુરેત ફરી ખાવાથી કરમિયા થવાની શક્યતા ખૂલ વધી જાય છે. રાંદ્યા વગરનો ખોરાક બિલકુલ ન લેવો. સલાડ પણ કાચા ન ખાવા. તલ અને ગોળનો સાથે ઉપયોગ ન કરવો. જેમકે તલનું કચરિયું. વાસી ખોરાક (રાતનું સવારે, બપોરનું રાતે) બિલકુલ ન ખાવું. ખાસ કરીને જમવાની સાથે દૂધ ન લેવું. પોઓા કે તેનો તળેલો ચેવડો ખાવો નહીં. માટી, પેન, ચોક વગેરે ન ખાવા. માંસ બિલકુલ ન ખાવું. ઇટાલિયન, ચાઈનીઝ-મેક્સીકન-પંલાણી વાનગીઓ લેવી નહીં. જંક ફૂડ, રેડી ટુ ઈટ પેકેટનો ઉપયોગ ન કરવો. ઉલ્ટી થતી હોય તો તેને ચોકવાનો પ્રયત્ન ન કરવો. નહાર રેકડીમાં મળતી ખુલ્લી વાસી વાનગીઓ ન ખાવી. 	
<p style="text-align: center;">દૂધ</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> દાડમ, પષેયુ. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> કેળાં, કોળું, બોર ખાસ ન ખાવા. તરબૂચ, ભામકણ, મોંસણી, લીંબુ વગેરે ખાટા અને કદુ કરનારા કુળ લેવા નહીં. <p style="text-align: center;">દૂધ અને દૂધની બનાવટો</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> વાવડીંગ નાખીને ઉકાળેલું ગાયનું દૂધ લેવું, હળદર, સૂંદ/આદુવાળું દૂધ. બકરીનું દૂધ કરમિયામાં લઈ શકાય. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> દહીં બિલકુલ ન લેવું. ભેંસનું દૂધ, પનીર, ચીજ, આઈસક્રીમ ન લેવું. 	<p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> હંમેશા ઉકાળેલું પાણી પીવું. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> તરસ કરતા વધુ પાણી ન પીવું. ફિઝનું પાણી બિલકુલ ન પીવું. મીઠા-ખાટા કલરવાળા બજારું હંડા પીણાં, બોર્નવિટા, ડ્રાયકૂટ (કોલિંક્સ) ન પીવા. 	

પાંડુ(અનિમિયા)નું પરેજુ પત્રક

અનાજ / કઠોળ	દૂધ અને દૂધની બનાવટો	વિહાર
<p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> એક વર્ષ જુના અનાજ વાપરવા. જૂના ઘડિયાના સહેજ ભર્દું દળોળા લોટમાંથી બનાવેલ અંશ (ભાખરી-રોટલી-લાપસી વગેરે). નાગલીના લોટની વાનગીઓ લેવી. મગ, તુયેર, મસૂરનો સુપ દેશી ગાયના ધીમાં વધારીને લેવા. 	<p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> દેશી ગાયનું દૂધ. બકરીનું દૂધ. તાજુ મોળી છાશ. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> ભેસનું દૂધ, દહીં, ધી. 	<p>શું કરવું :</p> <ul style="list-style-type: none"> બ્રાહ્મહૂર્તમાં (સૂર્યોદયથી ૮૬ મિનિટ પહેલા ઊઠવું.) પ્રસાદ વિત્ત રહેવું. નિયમિત વ્યાચામ-યોગ આસન કરવા. જમવા સુવાની નિયમિતતા કેળવવી. તાજો રાંધેલો, હુંકારો ગરમ ખોરાક જ લેવો. ઉગતા સૂર્યના કિરણોમાં ૧૦-૧૫ મિનિટ બેસવું.
<p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> ઘઉના જુણાલોટમાંથી બનાવેલ વાનગી, મેંદો, જેકરીની વસ્તુઓ. આથાવાળા ખોરાક ન લેવાં. ચાણા, વટાણા, અડદ, રાજમાં, વાલ, ચોળા, સોચાબીન જેવા કઠોળ. 	<p>પ્રવાહી</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> ઉકાળીને અડદું બળેવું પાણી આખો દિવસ પીવા વાપરવું. નાળીયેરનું પાણી પીવું. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> કોલ્ડિંક્સ વગેરે ઠંડા પીણાં, ફિઝનું હંડું પાણી ન પીવું. ચા-કોઝી ન લેવા. તરસ કરતાં વધારે પાણી પીવું નહીં. 	<p>શું ન કરવું :</p> <ul style="list-style-type: none"> સવારે મોડા (સૂર્યોદય પછી) ઊઠવું નહીં. કસમથે જમવું નહીં. જમીને તરત સૂવું નહીં. જમી લીધા બાદ ફરીને જમવું નહીં. રાત્રિ જાગરણ (આશરે રાત્રે ૧૦ વાગ્યા પછી) કરતું નહીં. મળ-મૂત્ર જેવા કુદરતી હાજરના વેગ રોકવા નહીં. દાર, તમાકુ, બીડી વગેરે નશાકારક વ્યસનોનો ત્યાગ કરવો. ચિંતા, શોક, રાત્રિ જાગરણ, શ્રમ ન કરવા. અધિક શ્રમ પડે તેટલું ચાલવું નહીં.
<p>શાકભાજુ</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> દૂધી, ગલકા, તુરીયા, પરવળ, કંકોડા જેવા પચવામાં હળવા અને વેલાવાળા શાક. મેથી, પાલક, તાંદળજાની ભાજુ, લીલી હળદર, આદું, કોળું, બીટ, લસણ, સરગવાનું શાક. શાક ઓછા પ્રમાણમાં અને દેશી ગાયના ધીમાં વધારીને લેવા. દૂધી, બીટ, ટેમેટા, પાલકનો સુપ. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> પચવામાં ભારે શાક જેવા કે બટેટા. કાચા શાકભાજુ (સલાદ) તથા વધુ પ્રમાણમાં શાક. કારેલા, સુકવેલા શાક, ભીડો, કોણી મૂળા ગુવાર, કંદમૂળ. 	<p>આહાર</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> હરડેનું જુના દેશી ગોળ સાથે નિયમિત સેવન કરતું. મુખવાસમાં શેકેલી વરીયાળી લેવી. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> કોઈપણ પ્રકારની ઠંડી વસ્તુ લેવી નહીં. તલ, સરસવ લેવા નહીં. વધારે મીહું ન લેવું. વધારે તીખો, ખાટો તળોલો ખોરાક ન લેવો. પિતર્વર્ક અંશ, દાર, તલની વાનગી ન લેવી. માંસ-માછલી-દંડા ન લેવા. ઇટાલિયન, ચાઈનીઝ, મેક્સિકન, પંજાબી વાનગીઓ ન લેવી. દૂધ સાથે તમામ ખાટા ફળો, અથાણાં, કુંગાળી, લસણ, મૂળા, ગાજર, ફરસાણ, આથાવાળી, ખારી વસ્તુ ન લેવી. પચવામાં ભારે ખોરાક, પેકેડ કૂડ (ચેડી દીંગ) ન લેવા. 	<p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> કોડલા (હાથલા)નો રસ. આમણા, દાડમ, સફરજન, પાકેલી કેરી, કણાં, દ્રાક્ષ, મોસંબી, નાળીયેર, ફાલલા, શેરડીનો રસ, ખજુર, કાળી દ્રાક્ષ (સૂકી), અંજુર. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> ભંબુ, કેરડા વગેરે.

હરસ-મસા-ભગંડરનું પરેજુ પત્રક

અનાજ / કઠોળ	દૂધ અને દૂધની બનાવટો	વિહાર
શું લેવું :	શું લેવું :	શું કરવું :
<ul style="list-style-type: none"> ■ એક વર્ષથી જુના ઘણીં, જવ, ચોખા લેવા. ■ ઘઉં-જવ સરખા ભાગે સહેજ લાડુ દળાવીને તે લોટમાંથી બનાવેલ રોટલા-રોટલી-ભાખરી લેવા. ■ મગ જેવા કઠોળ ગાયના દેશી ધીમાં વધારીને લેવા. 	<ul style="list-style-type: none"> ■ ગાયનું દેશી દૂધ તાજુ માખણ, બકરીનું દૂધ 	<ul style="list-style-type: none"> ■ બાધમુંહૂર્ત (સુર્યોદય થી ૮૬ મિનિટ પહેલા)માં ઉકટું. ■ નિયમિત યોગાસન, પ્રણાયમ, ધ્યાન કરવું. ■ મળત્યાગ બાદ ૭૫ મિનિટ સુધી હુંકાળું પાણી ભરેલ ટબમાં બેસીને ગુદાના ભાગે શેક કરવો. ■ હોસ્પિટલમાં ચિકિત્સકની સલાહ અનુસાર શરીરશુદ્ધિ માટે પંચકર્મ કરાવવાં.
શું ન લેવું :	શું ન લેવું :	શું ન કરવું :
<ul style="list-style-type: none"> ■ ઘઉના ઝુણા લોટમાંથી બનાવેલ વાનગી, મેંદો, આથાવાળા ખોરાક જેવા કે ઢોકળા વગેરે ન લેવા. ■ અડદ, વટાણા, સોયાબીન જેવા કઠોળ લેવા નહીં. 	<ul style="list-style-type: none"> ■ દહીં, મહો, આઈસ્ક્રીમ, લર્સી 	<ul style="list-style-type: none"> ■ સવારે મોડા સુર્યોદય પચી ઉઠું નહીં. ■ બેઠાડુ જીવન જીવનું નહીં. ■ કસમયે જમતું નહીં. ■ દિવસની ઉંઘ લેવી નહીં. ■ જ્મીને તરત સુધુ નહીં. ■ મળમુશ જેવા કુદરતી હાજર વેગ રોકવા નહીં. ■ મલ ત્યાગ સમયે વધુ પડતું જોર કરવું નહીં તથા કબજુયાત ન રહે તેનું દ્વાન રાખવું. ■ ઉલ્લક બેસતું નહીં. ■ જયા બાદ તરત જ વાહનની મુસાફરી કરવી નહીં. ■ દાર, તમાકુ, બીડી વગેરે નશાકારક વ્યસનનો ત્યાગ કરવો.
શાકભાજુ	પ્રવાહી	
શું લેવું :	શું લેવું :	
<ul style="list-style-type: none"> ■ ગલકા, તુરિયા, પરવળ, કારેલા, કંઠેલા જેવા પચવામાં હળવા શાક અને વેલાવાળા શાક અને લીલી હળદર, આદુ, સુરણકંડ, સરગવાનાં શાક લેવા. ■ શાક ઔષા પ્રમાણમાં, બાફીને અને વધાર કરીને લેવા. 	<ul style="list-style-type: none"> ■ સુંદ અને સુકા ધાણથી ઉકાળીને ઠારેલું પાણી પીવા માટે આખો દિવસ વાપરવું. 	
શું ન લેવું :	આહાર	
<ul style="list-style-type: none"> ■ ભીડા જેવા પચવામાં ભારે શાક લેવા નહીં. ■ કાચા શાકભાજુ (સલાડ) લેવા નહીં. ■ સુરણકંડ, રોંગણાં, સરગવાનું શાક લેવા નહીં. ■ વધુ પ્રમાણમાં શાક ખાવા હિતકારી નથી. 	<ul style="list-style-type: none"> ■ જમ્યા પહેલા હરડે અને ગોળ સરખા ભાગે લેવા. ■ મુખવાસમાં શેકેલા વરીયાળી, જીર, તલ લેવા. ■ તાજો રાંધેલો, હુંકાળો ગરમ ખોરાક જમવામાં લેવો. 	
ફળ	શું ન લેવું :	
શું લેવું :	શું લેવું :	
<ul style="list-style-type: none"> ■ આમળા, પાપૈયુ 	<ul style="list-style-type: none"> ■ માંસ, માછલી, ઈંડા લેવા નહીં. ■ વધુ પડતા તીખાં, ખાંટા, ખારા, તળેલા પદાર્થો લેવા નહીં. ■ દીટાલીયન, ચાઈનીઝ, મેક્સીકન, પંલબી વાનગી લેવી નહીં. ■ પેકેજ કુડસ લેવા નહીં. ■ દૂધ સાથે તમામ ખાંટા ફળો, અથાળા, કુંગળી, લસણ, મુળા, ગાજર, ફરસાણ, આથાવાળી, ખારી વસ્તુ ન ખાવી. 	
શું ન લેવું :	શું ન લેવું :	
<ul style="list-style-type: none"> ■ પાકી કેરી, પાકુ જીલુ, કાચા કેળા 		

હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, હાઈ બી.પી.નું પરેજુ પત્રક

અનાજ / કઠોળ	દૂધ અને દૂધની બનાવટો	વિષાર
<p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> એક વર્ષથી જુના ઘઉં, જવ, ચોખા, બાજરી, સામો, રાજગારો, મોરૈયો, મગ, મઠ, કળથી, દેશી ચણા, મસૂર, તુવેર, થેગી, ધાણી, મભરા, તેલ વગરનાં સાદા ખાખરા, ધેંસ, દાલિયા, ભડા-કરકરા લોટની રોટવી, ચોખાનું ઓસામણા. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> ઘઉંના જુણા લોટમાંથી બનાવેલ વાનગી, મેંદો, આથાવાળા ખોરાક જેવા કે ટોકળા વગરે ન લેવા. અડદ, રાજમા, વાલ, વટાણા જેવા કઠોળ લેવા નહીં. 	<p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> ગાયનું મલાઈ કાટેલું દૂધ, પાતળી છાસ, દહીનું નિતારેલું પાણી <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> ચીગ્ર, પનીર, મલાઈવાળું દૂધ, કાચું દહી, મિલ્ક શેક, લસ્કી, વધુ પડતા ચા-કોફી, આઈસ્ક્રીમ, શીખંડ, મહો, ચીકણા પદાર્થો, માવાની મીઠાઈ. 	<p>શું કરવું :</p> <ul style="list-style-type: none"> બ્રાહ્મુહૂર્તમાં (સુર્યોદય થી ૮૬ મિનિટ પહેલા) ઉછવું. નિયમિત ચોગાસન, પ્રાણાચામ, દ્વાન કરવું. <p>શું ન કરવું :</p> <ul style="list-style-type: none"> સવારે મોડા સુર્યોદય પછી ઉછવું નહીં. બેઠાડું જીવન જીવનું નહીં. વધુ પડતો શ્રમ, ભારે કસરત ન કરવી. ટીવી જોતાજોતા ન જમવું, જમ્યા પછી વધારે પાણી-છાસ ન પીવાં, હુંક પાણી ન પીવું. ભૂખ કરતાં વધારે ન જમવું. માત્ર સ્વાદ માટે ખાવું નહીં. તંબાકુ, દાર્ઢ જેવા વ્યસનથી દૂર રહેવું. ચિંતા, શોક, કોઘ, તણાવ કરવા નહીં. દૂધ સાથે તમામ ખાટા ફળો, અથાણાં, ઝુંગાલી, લસણ, મૂળા, ગાજર, ફરસાણ, આથાવાળી, ખારી વર્સુઅં ન ખાવી.
<p>શાકભાજુ</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> પરવળ, સરગવો, તુરીયા, ગલકા, દૂધી, ગાજર, રોંગણ જેવા પચવામાં હળવાં શાક. મેથી, પાલક, તાંદળજો, લુણી જેવી ભાજુ. સરગવા/શાકભાજુના સૂપ <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> ભીડા, ગુવાર, જેવા પચવામાં ભારે શાક લેવા નહીં. કંદમૂળ જેવા કે બટેકા, શક્કરીયાં, બીટ, સુરણ લેવા નહીં. 	<p>પ્રવાહી</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> ૧ લીટર પાણીમાં અડદી ચમચી સુંદર તથા ૨ ચમચી ધાણાનો પાવડર નાખી ઉકાળેલું પાણી પીવા મારે આખો દિવસ વાપરવું. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> તરસ કરતા વધુ પાણી પીવું નહીં, હુંક (ફિઝનું) પાણી ના પીવું. શેરડીનો રસ અને તેની બનાવટો, કોલ્ડફ્રીંક, લસ્કી, મિલ્કશેક લેવા નહીં. 	<p>આદાર</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> હિમેજ, આંબળા, અજમો, જીરું, વરીયાળીનો મુખવાસ લેવો. લસણની કળી દેશી ગાયનાં ધીમાં કકડાવીને ચટણી બનાવવી. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> ખાંડ, ગળપળા, ગોળ, કેક, ચોકલેટ, બેકરીની વર્સુઅં, અથાણાં, વારી ખોરાક, સોસ, રિપા, તળેલા પાપડ, માંસ, માઇલી, ઈડા લેવા નહીં. વધુ પડતા તીખાં, ખાંટા, ખારા, તળેલા પદાર્થો લેવા નહીં. ઇટાલિયન, ચાઈનીગ્ર, મેન્ડિસિકન, પંલબી વાનગીઓ, ફરસાણ લેવા નહીં.
<p>તેલ / ધી</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> તલનું તેલ, ગાયનું દેશી ધી. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> સોયાબીન, કપાસિયા, સૂરજમુખી, કરડી, પામ વગેરેના તેલ, વનસ્પતિ ધી. વધુ પડતાં ધી-માખણયુક્ત ખોરાક. 		
<p>ફળ</p> <p>શું લેવું :</p> <ul style="list-style-type: none"> આમણા, પફેચુ, નારંગી, કોર્કું, જાંબુ, પાકી કેર્વી, દાડમ, ફાલસા જેવા ખાટા રૈસાવાળા ફળો. <p>શું ન લેવું :</p> <ul style="list-style-type: none"> કેળા, ચીકું જેવા મીઠા અને ગરવાળા ફળો. 		

નિયામકશ્રી, આયુષ, ગુજરાત રાજ્યના તાબા હેઠળની તાપીબાઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભાવનગર.

૭૫ કરતા વધુ વર્ષોથી અવિરત દર્દી નારાયણની જુની શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા થકી સેવા કરનાર શ્રી તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલ, ભાવનગર તથા શેઠ પી. સરકારી આયુર્વેદ કોલેજના કર્મચ વિવિધ રોગોના નિષાંત ડોક્ટરોની ટીમ દ્વારા નીચે મુજબનાં અલગ અલગ વિભાગોમાં વિવિધ રોગોની ઓ.પી.ડી. (રોજની દવા આપીને) તથા આઈ.પી.ડી. (દાખલ કરીને) જમવા સાથે સંપૂર્ણ નિદાન તથા સારવાર નિઃશુદ્ધ આપવામાં આવે છે.

- ◆ કેસ કાટવાલો સમય : સોમવાર થી શુક્રવાર : સવારે ૮:૪૫ થી ૧૨:૧૫ અને બપોરે ૨:૪૫ થી ૪:૪૫
શનિવાર સવારે ૮:૪૫ થી ૧૨:૩૦
- ◆ કાર્યચિકિત્સા વિભાગ : તાવ, માથાનો દુઃખાવો, કબજુયાત, એસિડિટી વગેરે પાચનતંત્રના રોગો, દમ, શ્વાસ, ઉધરસ, જુની શરદી, હોલર્ઝ, હાઇ બીપી, પથરી, પેશાબનો અટકાવ તથા ચિંતા, બેચેની, ઊંઘ ન આવવી, માનસિક તથા જાતીય રોગો વગેરે
- ◆ પંચકર્મ વિભાગ : ખરબજું, સોરાઈસીસ, સફેદ ડાઘ વગેરે ચામડીના રોગો, જાડાપણું, થાઈરોઈદ, ડાયાબીટીસ વગેરે
 - વા, સાંધા, ટીચણ, કમરનાં દુઃખાવાનાં, સ્નાયુ તથા માંસપેશીનાં રોગો
 - પક્ષાધાત, મગજ તથા ચેતાતંત્ર લગતા રોગોમાં માલિશ તથા સેક સાથે પંચકર્મ દ્વારા સારવાર
- ◆ ભર્મ ચિકિત્સા વિભાગ : રોગના કારણે કે રમત ગમતનાં કારણે થનાર દુઃખાવા તેમજ ઝાનતંતુનાં રોગોમાં તાત્કાલિક અસરકારક પેઇન મેનેજમેન્ટ કિલનિક
- ◆ ફિઝીયોયેરાપી (કલ્સરત) વિભાગ : પંચકર્મ વિભાગ અંતર્ગત સાધન સંપ્રદ્ધ ફિઝીયોયેરાપી વિભાગમાં નિષાંત ફિઝીયોયેરાપીસ્ટ દ્વારા રોગાનુસાર કસરત અને માર્ગદર્શન
- ◆ શાલ્વ વિભાગ : ક્ષારસૂદ્રથી - હરસ, મસા, ભગંદર જેવા માળમાર્ગનાં રોગો, કપાસી, શરીર પરના મસા, ગાંઠ, સાઈટીકા (રાંજણ), સ્નાયુનો દુઃખાવો, ખરબજું, દાદર જેવા રોગોની સારવાર
- ◆ બાળરોગ વિભાગ : બાળકોમાં થતા રોગો જેવા કે કૃમિ, વજન ના વધવું, કાકડા વધવા, માટી ખાવી, ઝાડા, ઉલટી, પાચનતંત્રનાં રોગો, મગજનો યોગ્ય વિકાસ ન થવો, લક્ષ્ય, પક્ષાધાત વગેરે સ્નાયુ-માંસપેશીનાં રોગો પુષ્યનક્ષત્રનાં દિવસે સુવર્ણ પ્રાશન કરવામાં આવશે.
- ◆ પ્રશ્નુતિ અને ટ્રીરોગ : માસિકને લગતી તકલીફો, સફેદ પાણી પડવું, ગર્ભશયની ગાંઠ, ચાંદી પડવી, વંદ્યાત્વ (વાંજુયાપણું), સ્ટનમાં ગાંઠ, ધાવણ ઓછું આવવું, નોર્મલ ડિલીવરી થાય તે માટે માર્ગદર્શન, ઉત્તમ સંતાન પ્રાપ્તિ અર્થે “ગર્ભસંસ્કાર”
- ◆ શાલકાયતંત્ર વિભાગ : અંખના રોગો, કાન, નાક, ગળાનાં રોગો, દાંત, પેઢા, મૌનાં રોગો, ચશમાનાં નંબર ચેક કરી આપવામાં આવશે, કાનની બુટનાં ટાંકા, જલંઘર બંધ પદ્ધતિથી દુખાવા વગર હાલતા દાંત પાડી આપવામાં આવશે.
- ◆ સ્વસ્થબૃત વિભાગ : દર મંગળવારે મેદસ્થિતા (જાડીયાપણું) માટેની સ્પેશિયલ સારવાર
 - દર બુધવારે ડાયાબિટીસ માટેની સ્પેશિયલ સારવાર
 - વૃદ્ધાવસ્થાજન્ય રોગો માટે દરરોજ સારવાર
 - સંલગ્ન યોગા અને નિસર્ગોપચાર માટે વેલનેસ સેન્ટરની સુવિધા
- ◆ હોમિયોપથી ચિકિત્સા : વિવિધ પ્રકારનાં શારીરિક તથા માનસિક વિકારો માટે હોમિયોપથી સારવાર
- ◆ નિઃશુદ્ધ સ્વાસ્થ્યવર્ધક અમૃતપેય (ઉકાળા) : દરરોજ સવારે ૭ થી ૯ માં હોસ્પિટલનાં પટાંગણમાં અપાશે.